

RAN-1901130703050002**M.A. (Sem. III) Examination March - 2026****Economics (Paper - 15 : ID-3-B) Banking And Insurance****Time: 2 Hours]****[Total Marks: 50**

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) પ્રશ્ન 1 ફરજિયાત પ્રશ્ન છે. Question 1 is compulsory. (3) જમણી બાજુ પર દર્શાવેલા અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે. Figure of the right indicate full marks of the questions.	Seat No.: Student's Signature
--	--

- પ્ર. 1.** નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. **10**
1. બેંકની સર્વસ્વીકૃત કોઈપણ એક વ્યાખ્યા લખો.
 2. RTGS વિશે ટૂંકમાં જણાવો.
 3. ભારતીય જીવનવીમા નિગમની કોઈપણ ચાર પોલિસીના નામ આપો.
 4. વીમાના ગેરફાયદા જણાવો.
 5. બેસલ નોર્મ્સ (Basel Norms) વિશે જણાવો.
- પ્ર. 2.** ભારતના આર્થિક વિકાસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ભૂમિકા તપાસો. **13**
- અથવા**
- (અ) તરલતાનો ખ્યાલ સમજાવો. **07**
 (બ) ઑનલાઈન બેંકિંગના લાભ-ગેરલાભ સમજાવો. **06**
- પ્ર. 3.** ઈરડા (IRDAI) નો પરીચય આપી તેની સત્તાઓ, ફરજો અને કાર્યોની વિસ્તૃત સમજૂતી આપો. **13**
- અથવા**
- જીવનવીમાની વ્યાખ્યા જણાવી જીવનવીમાના કોઈપણ બે સિદ્ધાંતો વિગતવાર સમજાવો.
- પ્ર. 4.** ટૂંકનોંધ લખો (કોઈપણ બે) **14**
1. આધુનિક વ્યાપારી બેંકોના બિનપ્રણાલિકાગત કાર્યો
 2. બેંકિંગ સેવાના માર્કેટિંગનાં 6P નો ઉપયોગ
 3. વીમાના વિવિધ કાર્યો
 4. આગનો વીમો

ENGLISH VERSION

- Q. 1.** Answer the following questions in brief. **10**
- (1) Write any one generally accepted definition of a bank.
 - (2) Briefly explain about RTGS.
 - (3) Name any four policies of Life Insurance Corporation of India.
 - (4) Explain the disadvantages of insurance.
 - (5) Explain about Basel Norms.

- Q. 2.** Examine the role of the Reserve Bank of India in the economic development of India. **13**
- OR**
- Q. 2.(A)** Explain the concept of liquidity. **07**
- (B)** Explain the advantages and disadvantages of online banking. **06**
- Q. 3.** Introduce IRDAI and give a detailed explanation of its powers, duties and functions. **13**
- OR**
- Q. 3.** Explain the definition of life insurance and explain any two principles of life insurance in detail. **13**
- Q. 4.** **Write a short note. (Any two)** **14**
- (1) Non-traditional functions of modern commercial banks
 - (2) Use of 6P in marketing of banking services
 - (3) Various functions of insurance
 - (4) Fire insurance.
-